

બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૦૭/૧૧/૨૦૨૧ સુધી)

(૧)

તા.૦૧/૧૧/૨૦૨૧ ક.૧૪/૩૦ વાગે મોજે કરઝા-જાલરા ગામની સીમમા આ કામના તહેદાર રામસિંહ મેપાતસિંહ ચૌહાણ રહે.ચૌહાણગઢ તા.અમીરગઢ વાળાએ ગણપતસિંહ ઓહુસિંહ ચૌહાણ રહે.ઝાલરા-કરઝા વાળાના બંધ મકાનમા ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના ઇંગ્લીશ દાઝની બોટલો તથા બીયર ટીન કુલ નંગ-૫૦૬ કિં.રૂ.૧,૦૦,૩૧૦/- નો મુદામાલ રાખી પોલીસ રેઇડ દરમ્યાન ધરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોઇ દાંતીવાડા પો.સ્ટે.પાર્ટ-સી.ગુ.ર.નં.૧૧૧૯૫૦૬૧૨૧૦૯૨૬/૨૦૨૧ ધી પ્રોહી એક્ટ ક.૬૫એઇ ,૧૬૬બી મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

તા.૦૧/૧૧/૨૦૨૧ ના ક.૧૯/૧૦ વાગે મોજે દુધવા ગામે રોડ ઉપર આ કામના તહેદાર મજકુર વિક્રમભાઇ રામજીભાઇ રાજપુત તથા નરસિંહભાઇ બીજોલજી ઠાકોર રહે બન્ને- વાસણા (વાતમ) તા-લાખણીવાળાઓએ તેમના કબ્જા ભોગવટાની અલ્ટો ગાડી રજિ.નં- જીજે ૦૧ કે એલ ૧૧૦૯મા ગે.કા વગર પાસપરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દાઝ પેટી નંગ ૧૦ કુલ બોટલ નં-૪૮૦ કુલ કિ.રૂ. ૪૮૦૦૦/- તથા મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- તથા અલ્ટો ગાડી કિ.રૂ. ૧૦૦૦૦૦/- આમ કુલ મુદામાલ ૧૫૩૦૦૦/-ના સાથે આરોપી નં-૧ પકડાઇ જઇ આરોપી નં-૨ નાશી જઇ બન્ને ગુનો કરવામા એકબીજાએ મદદગારી કરી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોઇ થરાદ પો.સ્ટે.પાર્ટ-સી.ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૮૨૧૧૨૧૨ પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ), (ઇ), ૧૧૬(૨), ૯૮(૨), ૯૯, ૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

તા.૦૪/૧૧/૨૦૨૧ ના ક.૦૭/૦૦ વાગે મોજે કિડોતર ગામની સીમ પંજાબી ધાબા નજીક હાઇવે રોડ આ કામના આરોપી રોહીત મોહનલાલ સુથાર રહે.મુંબઇ શાંતીનગર સી બીલ્ડીંગ જૈન ટેમ્પલ ભાઇન્દર વેસ્ટવાળો પોતાની કબ્જા ભોગવટાની સ્કોડા ઓક્ટીવીઆ ગાડી નં.MH04CM4487 માં ગે.કા અને વગર પાસપરમીટની ભારતીય બનાવટનો વિદેશી દાઝની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૪૮,૦૦૦/- ની હેરાફેરી કરી તથા સ્કોડા ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૪,૫૦,૦૦૦/- તથા સાથે પોલીસ નાકાબંધી દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ હોઇ અમીરગઢ પો.સ્ટે.પાર્ટ-સી.ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૩૨૧૦૮૦૮/૨૦૨૧ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ એઇ, ૧૧૬(બી), ૯૮(૨), ૮૩ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.